

## ગુજરાતી ભાષાની ઉત્કાંતિ'ને દસ્તાવેજ આદેખ જ્યંત કેઠારી

સુંબદ્ર યુનિવર્સિટીના ઈ. સ. ૧૯૩૮-૩૯નાં ડક્કર વિસનજી માધવજી વ્યાખ્યાનો પંડિત એચરદાસ દોશીએ 'ગુજરાતી ભાષાની ઉત્કાંતિ' એ વિષય પર ૧૯૪૦માં આપ્યાં અને એ વ્યાખ્યાનો પુસ્તક ઇથે ૧૯૪૩માં પ્રસિદ્ધ થયાં.<sup>૧</sup> આ વ્યાખ્યાનો એની પદ્ધતિ અને એનાં ફેટલાંક પ્રતિપાદનોને કારણે નોંધપાત્ર બને છે.

કુલ પાંચ વ્યાખ્યાનોમાંથી, સુખ્ય વિષયના 'આસુખ' તરીકે યોજયેલું 'પહેલું' વ્યાખ્યાન ૨૧૮ પાનાં સુધી વિસ્તરે છે અને ગુજરાતી ભાષાની પૂર્વપરંપરાનો વિગતે પરિચય આપવા તાકે છે. બાકીનાં ચાર વ્યાખ્યાનોમાં અતુકુમે ૧૨મા-૧૩મા, ૧૪મા-૧૫મા, ૧૬મા-૧૭મા અને ૧૮મા સૈકાની ગુજરાતી ભાષાના સ્વરૂપનું વિશ્લેષણ છુટકી પાનાંમાં ૨૪૬ પાનાંમાં ૨૪૭ થયું છે.

પહેલા વ્યાખ્યાનમાં સૌ પ્રથમ શબ્દસ્વરૂપ, ધ્વનિઓ, ભાષાસ્વરૂપ, ભાષાલેદ વજેરે વિષયોનું આચીન ભતાતુસારી નિરૂપણ થયું છે. આચીન પરંપરાના દોઢન તરીકે એ અવશ્ય ઉપયોગી છે પણ આધુનિક ભાષાવિજ્ઞાને આ વિષયોમાં જે ફેટલીક ભૂળગામી વિચારણા કરી છે એનાથી સાવ અસ્પૃષ્ટ રહીને થયેલું નિરૂપણ આજે એકાંગી લાગે અને એ ફિલ્મે થયેલા ભાષાવિશ્લેષણુંને ફેટલીક ગંભીર મર્યાદાઓ નહે એમાં નવાઈ નથી.

આ પછી પંડિતજીએ વૈદિક, લીલિક સંસ્કૃત, પ્રાકૃત, પ્રાકૃતભેદો, અપભ્રંશ - આ ભધાંતું સ્વરૂપ સંસ્કૃત કર્યું છે અને એમના પરસ્પરના સંબંધ અંગે ફેટલોક જીડિયોહ કર્યો છે. એમાં એમની એક ભહેતરતની સ્થાપના તે વૈદિક સાથે પ્રાકૃતનો ગાઢ સંબંધ હોવા વિશેની છે, જે એમણે ખૂબ વિગતે ચચ્ચી<sup>૨</sup> છે. સંસ્કૃત (એટથે લીલિક સંસ્કૃત)ને એ નાની બહેન અને પ્રાકૃતને માટી બહેન ગણ્યાવે છે અને સંસ્કૃત પર પડેલા પ્રાકૃતના પ્રલાવનું વણ્ણુંન કરે છે. એથી જ એ 'તદ્દલવ' અને 'સંસ્કૃતયોગિનિ' એ શંહોનું અનૌચિયત્વ પણ દર્શાવે છે. પંડિતજી, અલખપત્ર, પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત આવી છે એવા રાજશૈખરના ભતોનો પણ વિરાધ કરે છે. સંસ્કૃત અને પ્રાકૃતને બહેનો ગણ્યાવનાર આ ભત પણ ન સીકારી શકે એ સ્વાભાવિક છે. પંડિતજીનું આ ભાષાદ્શર્ણન અત્યંત સ્પષ્ટ છે અને ભારપૂરક સુકાયેલું છે પણ એ સાધાર છે અને એકાંગી થઈ જવાના જેખમભાંથી જિગરી ગણ્યાનું છે. પંડિતજીએ પ્રાકૃત ભાષાના અભ્યાસનો આગ્રહ વ્યક્ત કર્યો છે તે ભારતીય-આર્ય ભાષાના વિકાસમાં પ્રાકૃતનું જે ભહેતરવલબ્ધું સ્થાન એમણે દર્શાવ્યું છે તે જેતાં પૂરેપૂરો ઉચિત લાગે છે.

પંડિતજીએ અપભ્રંશનો સંબંધ પણ આદિમ પ્રાકૃત સાથે જેડિયો છે તથા સંસ્કૃત અને પ્રાકૃતની સાથે અપભ્રંશને પણ નીજ બહેન ગણ્યાવી છે. પ્રાકૃતની જેમ અપભ્રંશના ભૂળને છેક પ્રામીનકાળમાં લઈ જવાનું ફેટલુંક ઉચિત ગણ્યાય એ ગ્રન્થ છે, પણ એ દ્વારા લોકભાષાનું સાતત્ય તો સુચવાય છે. પંડિતજી 'અપભ્રંશ' શબ્દના સામાન્ય અર્થ અને વિશેષ અર્થનો લેદ કરે છે તથા પ્રાહેશિક અપભ્રંશા હોવાનું સ્વીકારે છે પણ એમની વરચ્ચે નજીવો ફરક હોવાનું જણ્યાવે છે.

૧. 'ગુજરાતી ભાષાની ઉત્કાંતિ' (ભારતી સૈકાથી અઠારતી સૈકા સુધી), અધ્યાત્મક એચરદાસ જીવરાજ દોશી, સુંબદ્ર યુનિવર્સિટી, ૧૯૪૩.

અપભ્રંશને ગુજરાતીની માતા, વ્યાપક પ્રાકૃત ને મોટી માસી ને સંસ્કૃતને નાની માસી તથા વૈદિક યુગના આદિમ પ્રાકૃતને માતામહી ગણુણી પંડિતજી ગુજરાતીમાં એ માતામહીનો વારસો પણ શાધી ષટાવે છે. આમાં ધ્યેણું સ્થાને આકષિમક્તાનો આશ્રય લેવાઈ ગયો હોય એવું જણાય છે.

પંડિતજીની એક અત્યંત વિલક્ષણ ને વિવાદસ્પદ સ્થાપના તે ગુજરાતી ભાષાના આરંભ વિશેની છે, એ હેમચંદ્રના અપભ્રંશમાં જગતી ગુજરાતીની પ્રક્રિયા જેવા આગળ અટકતા નથી, હેમચંદ્રને ગુજરાતીના પાણિનિ અને સાહિત્યની ગુજરાતીના વાદ્મોક્તિ - આદ્ય કલિ કહેવા સુધી પહોંચે છે અને પછીથી ૧૨માં સૈકાની ગુજરાતી ભાષાના અભ્યાસમાં અભ્યદેવ, વાદ્વિવેસુરિ, હેમચંદ્ર વગેરેની કૃતિઓને સમાચી લે છે. ડૉ. હરિવલલબ ભાયાણી દર્શાવે છે<sup>૨</sup> તેમ સંસ્કૃત દર્શનના મંજુલાવના લેદક લક્ષ્યનું અવગણી ઉક્ત અપભ્રંશ કૃતિઓને ગુજરાતી ડરાવી હેવાઈ છે, તે ઉપરાંત પંડિતજી પોતાની ડોઈ તાર્કિક કે સ્થિર ભૂમિકા જલ્દી કરી શક્યા નથી. અભ્યદેવસુરિના સ્તોત્ર વિશે તથે કહે છે<sup>૩</sup> “રચનાર ગુજરાતી, રચનાનું સ્થળ ગુજરાતનું એક ગામ એ જેતાં સ્તોત્રની ભાષા પણ સાપેક્ષ રીતે ગુજરાતી કહેવાય.” જ્યેણું ભાષાકીય લાક્ષ્ણિકતાઓ અપ્રસ્તુત હોય! ઉક્ત કૃતિઓનાં ને વ્યાકરણુગત લક્ષ્યાણી પંડિતજીએ તારદ્વાં છે એ બહુધા અપભ્રંશનાં જ છે અને પંડિતજી પોતે એમાં હેમચંદ્રે ને (જગતી ગુજરાતીનું!) વ્યાકરણ લખ્યું છે તેના નિયમોથી, સાધારણું ઉચ્ચારણુંબેદ સિવાય છોઈ લેદ જોતા નથી.

૧૩માં સૈકાના ‘જાન્યુઆરીય’ની ભાષાને જગતી ગુજરાતી કહેવા કરતાં કુમાર ગુજરાતી કહેવી જોઈએ એમ પંડિતજી નોંધે છે. એનો અર્થ એટલો જ કે એમાં અપભ્રંશોત્તર ભૂમિકાની ભાષા જેવા મળે છે, ‘ઉપસંહાર’માં પંડિતજીનાં વાક્યો વધારે ધોતક છે :

“બારમા સૈકાની ગુજરાતી ભાષાનો શખદહેં પ્રાકૃતની જેવો છે.”

“તેરમા સૈકાની ભાષામાં પ્રાકૃતપણું આછું હેખાય છે.” પંડિતજીએ આ વિધાનોને સંગત રહીને જ પોતાનાં વ્યાખ્યાનોમાં ભાષાવિકાસનું ચિત્ર આદેખ્યું હોત તો ?

ખીનથી પાંચમા વ્યાખ્યાનમાં પંડિતજીએ ૧૨માથી ૧૮માં સૈકા સુધીનું ગુજરાતી ભાષાના વિકાસનું ને ચિત્ર આદ્યું છે તે એની પદ્ધતિની દર્શિયે ખૂબ ધ્યાનપાત્ર છે. એમણે દરેક સૈકાની નમૂનાઃપ કેટલીક કૃતિઓ કે કૃતિ-અંશો લીધા છે અને એમાંથી ભાષાસામની લઈ પોતાનું વિશ્લેષણ પ્રસ્તુત કર્યું છે - શખદહેંડોળ નોંધ્યું છે, વ્યાકરણી ઇપોનો પરિયય કરાવ્યો છે અને કેટલીક વ્યુટપત્તિયાંની પણ કરી છે. ભાષાવિકાસનો આ જતનો પ્રયોગમૂલક અભ્યાસ હજુ સુધી આપણે ત્યાં વિરલ છે, એ રીતે એતું વિશિષ્ટ મુખ્ય છે.

અધાં વ્યાખ્યાનોમાં પંડિતજી અનેક શખદો અને શખદધર્ટોનાં મૂળ દર્શાવતા રહ્યા છે. પંડિતજીએ પોતે એક વખત અક્ષરસામ્યથી હોરવાના સામે ચેતવણી આપી છે (પૃ. ૨૫૨) જ્ઞાનાં પોતે એમાંથી સાવ અચી શક્યા છે એવું નથી. ધ્રવનિશાખના સ્થાપિત થઈ ચૂકેલા સામાન્ય નિયમો અને ગુજરાતી ભાષાની વ્યુટપત્તિના વિષયમાં એમની પૂર્વે થયેલા કામનો પંડિતજીએ સામાન્ય રીતે લાલ લીધેલો જણાતો નથી, તેથી વ્યુટપત્તિને નામે શખદોની સમાનાતરતાએ નોંધવા જેવું જ બહુધા થયું છે. ધ્યેણું ઠેકાણું તો પંડિતજી પોતે અટકળની ભૂમિકાએ છે એ એમણે સૂચયવેલી વૈકલ્પિક

૨. વાગ્વાયાપાર, ૧૯૫૪, પૃ. ૩૭૬.

વ્યુતપ્તિઓ પરથી સમન્ય છે. એ પોતે ચોક્કસ વ્યુતપ્તિ આપે છે કે અમુક વ્યુતપ્તિ તરફ પ્રક્ષપાત અતાવે છે લારે એને માટે ધ્વનિશાખના સ્વીકૃત નિયમોનો કે વ્યાકરણી હકીકોતોનો ભાગે જ આધાર હોય છે. થોડા ઉદાહરણો જોવાથી આ વાતની પ્રતીતિ થશે:

'કરવાનુ'ની વ્યુતપ્તિ પંડિતજી 'તવ્યતીથ' અને 'તથુ'ને આધારે સૂચવે છે અને પહેલી યુક્તિને સંગત ગણે છે પણ 'કરવાનુ' એ 'કરવું'નુ 'ન-' પ્રત્યય લાગ્યાને થયેલું વિસ્તરણ છે એ તરફ એમનું લક્ષ ગયું નથી.

ગુજરાતીનો ભાવવાચક 'આઈ' પ્રત્યય વૈદિક 'તાતિ'માંથી અને ગુજરાતીનો પરિમાણવાચક 'ના' ('ક્રિપ્તિમાનો પગાર' વગેરેમાં) વૈદિક 'ઇન્ન' માંથી હોવાનો તર્ક પંડિતજી કરે છે, જે સ્વીકારવા માટે ભાગે જ કરો આધાર છે. ગુજરાતીના 'ન-' પ્રત્યયની વ્યાપકતા પંડિતજીએ બરાબર વિચારી હોત તો એને 'ઇન્ન'માંથી ઘટાવવાનો વિચાર એ ન જ કરત. ગુજરાતીમાં વૈદિકનો વારસો અતાવવાનો ઉત્સાહ એમને આવી ફેટલીક વ્યુતપ્તિઓ તરફ એંચી ગયો લાગે છે.

'નાતનુ' ની વ્યુતપ્તિ 'શાતિ' ઉપરથી સૂચવી પાદ્ધિપમાં પંડિતજી એની 'શાત્યન્તરમ' સાથેની સમાનતા નિર્દેશ છે અને પાછા 'શાતિ-ધતર'નો સંભવ પણ નોંધે છે! પંડિતજી પાસે સાર્વત્રિક ધ્વનિનિયમોની ભૂમિકા હોત તો એ સહેલાઈથી સીધા 'શાત્યન્તરમ' પર જ સ્થિર થઈ શક્યા હોત.

'ગમાર' શબ્દ ફારસી 'ગુમરાહ'નું ઇપાંતર લાગે છે એમ કહ્યા પણ પંડિતજી હેમયન્દે નોંધેલા 'ગુમમ' ધાતુ અને 'આભ્યાચાર' પરથી પણ એની વ્યુતપ્તિ સૂચવે છે વારે વારે પ્રગટ થતી આ જાતની અનિર્ણયાત્મકતા ભાષાવિકાસના ધોરી માર્ગેને પ્રકાશિત કરવાનું કામ ભાગે જ કરી શકે.

અતાં વ્યુતપ્તિ નિમિતે જુદી જુદી ભૂમિકાની ધારી ભાષાસામગ્રોનું અહીં સંનિધાન થયું છે. ભાષાસંશોધકો એને કાચી સામગ્રી તરીકે જરૂર ઉપયોગમાં લઈ શકે.

પંડિતજીએ ધણ્ણા અક્ષાસપૂર્વક આ વ્યાખ્યાનો તૈયાર કર્યાં છે અને પોતાની સર્વ જાણકારી કરે લગડી છે. એમના નિરપણમાં ધણ્ણી વિશદ્ધતા અને સંદોગમ્યતા છે, વૈદિકથી માંડી ગુજરાતી સુલ્લાની પ્રચુર ભાષાસામગ્રી એમણે કામમાં લીધી છું અને પ્રેરોગમૂલક અક્ષાસની એક વૈજ્ઞાનિક પદ્ધતિનો એમણે આશ્રય લીધો છે. આમ અતાં વિષય પર જેઠીએ તેવે પ્રકાશ પડતો ન લાગતો હોય તો એનાં ફેટલાક કારણો છે. એમણે, ડૉ. ભાષાશુદ્ધી કહ્યું છે, તેમ આધુનિક મૌલિક પૂર્વ-કાર્યથી લગભગ નિરપેક્ષ રહ્યેને વિષયનું નિરપણ કર્યું છે, પોતે જેમનો આધાર લીધો છે તે તે યારું, નિરુક્તા, હેમયન્દ્રાદિની સામગ્રીને ચકાસવાનો પ્રયત્ન કર્યો નથી તથા માહિતી નોંધવાનો અને સમાન્તરતાઓ નિર્દેશવાનો અમ લીધો છે તેટથો નિયમો કે વલણો તારવવાનો લીધો નથી. એથી જ ઉપસંહારના પ્રકરણમાં થોડા વ્યાપક પ્રકારનાં તારણો ઉપરાંત કંઈ નક્કર એ આપી શક્યા નથી. આમ અતાં પંડિતજીએ ગુજરાતી ભાષાના વિકાસના અક્ષાસની એક દિશા એથી આપી છે, જે હજુ જાગી એડાયેલી નથી. પંડિતજીનું આ પ્રદાન નોંધપાત્ર ગણું શક્યા નથી.